

પાઠ 20

દૂધ સહકારી મંડળી

સરપંચ : મુખી, તમારા બધાંના સહયોગથી દૂધ સહકારી મંડળીનું પોતાનું મકાન તો બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેનું ઉદ્ઘાટન પણ કરાવવું પડશે. કહો, તેના માટે કોની સાથે વાત કરીએ?

મુખી : આપણે દૂધ મંડળીના અધ્યક્ષને જ વાત કરીએ. પર્યાવરણ દિવસ પણ આવી રહ્યો છે. આપણે આપણી ગૌચરભૂમિમાં વૃક્ષારોપણ પણ કરાવડાવવું પડશે. અત્યારથી કેટલાક વૃક્ષો વવડાવી લઈશું તો થોડા વર્ષોમાં છાંધકો થઈ જશે, અને પશુઓને ચરાવવામાં સરળતા રહેશે.

સરપંચ : સારું છે. એવું જ કરીએ છીએ. આપણે કાલે જ શહેર જઈને અધ્યક્ષશ્રી અંબાલાલભાઈને મળવા જઈશું. એ પણ નક્કી કરી લઈએ કે આપણે આપણી સાથે બીજા કોને કોને લઈ જવાના છે.

મુખી : આપણી શાળાના શિક્ષક પૂરણભાઈ ખૂબ સમજદાર છે. તેમને તો આપણી સાથે લઈ જ જવા પડશે. તે અધ્યક્ષશ્રી સાથે સારી રીતે વાત પણ કરી લેશે અને તેમને બધું સમજાવી

દુધ સહકારી સમિતિ

સરપંચ : મુખ્યિયા જી, આપ સબકે સહયોગ સે દુધ સહકારી સમિતિ કા અપના ભવન તો બનકર તૈયાર હોગયા હૈ। અબ ઇસકા ઉદ્ઘાટન ભી કરવાના પડેગા। બતાઇએ ઇસકે લિએ કિસ સે બાત કરેં?

મુખ્યિયા : હમ દુધ સમિતિ કે અધ્યક્ષ જી સે હી બાત કરોં। પર્યાવરણ દિવસ ભી આ રહા હૈ। હમેં અપની ચરાહગાહ મેં વૃક્ષારોપણ ભી કરવાના પડેગા। અભી સે કુછ વૃક્ષ લગવા લેંગે તો કુછ વર્ષો મેં ઉનકી છાયા હો જાએગી ઔર પશુઓં કો ચરાને મેં સુવિધા રહેગી।

સરપંચ : ઠીક હૈ। એસા હી કરતે હોયાં। હમ કલ હી શહર ચલ કર અધ્યક્ષ શ્રી અંબાલાલ ભાઈ સે મિલને જાએંગે। યહ ભી તય કર લેં કી, હમેં અપને સાથ ઔર કિસ-કિસ કો લે જાના હૈ।

મુખ્યિયા : અપની શાળા કે શિક્ષક પૂરનભાઈ બહુત સમજદાર હૈનું। ઉન્હેં તો અપને સાથ લે હી જાના પડેગા। વે અધ્યક્ષજી સે અચ્છી તરહ બાત ભી કર લેંગે ઔર ઉન્હેં સબ કુછ સમજા ભી દેંગે। ઉદ્ઘાટન કા લિખિત કાર્યક્રમ ભી તો બનવાના પડેગા।

પણ દેશે. ઉદ્ઘાટનનો લેખિત કાર્યક્રમ પણ બનાવડાવવો પડશે. પૂરણભાઈ જ સારી રીતે બનાવડાવી શકશે.

સરપંચ : સાંનું. કાલે જ જઈશું. પૂરણભાઈને હું બોલાવડાવી લઈશ. જો બીજા કોઈને બોલાવડાવવા હોય તો જણાવો.

મુખી : બીજા તો કોઈને નથી લઈ જવા. હમણાં તો આપણે ત્રણ જ જઈશું. કાલે શહેર જવા હું મારી ગાડી તૈયાર કરાવડાવું છું. આપણે સવારે દસ વાગે જઈશું. નવ વાગે ગાડી તમારા ધરે મોકલાવી દઈશ. તમે તૈયાર રહેજો. (બીજા દિવસે ત્રણે દૂધ સહકારી મંડળીના અધ્યક્ષના કાર્યાલય પહોંચે છે)

સરપંચ : અધ્યક્ષજી અમે અંદર આવી જઈએ?

અધ્યક્ષ : આવો, આવો. સરપંચજી આવો. ઓહો! મુખી અને પૂરણભાઈ પણ સાથે આવ્યા છે. લાગે છે કે કોઈ નવી યોજના બનાવી છે.

ત્રણ : નમસ્કાર સાહેબ.

અધ્યક્ષ : નમસ્કાર. બેસો. કહો કે કેમ આવવાનું થયું?

સરપંચ : અમે આપની પ્રેરણા અને સહયોગથી અમારા ગામમાં દૂધ મંડળીનું મકાન બનાવડાવીને તૈયાર કરાવડાવી દીધું છે. બધાંની દિચણ છે કે તે મકાનનું ઉદ્ઘાટન આપની પાસે કરાવીએ.

કાર્યક્રમ ભી પૂરણ જી હી ઠીક સે બનવા સકેંગે।

સરપંચ : ઠીક હૈ। કલ હી ચલેંગે। પૂરણ જી કો મૈં બુલવાલુંગા। યદિ ઔર કિસી કો બુલવાના હો તો બતાઇએ।

મુખ્યિયા : ઔર કિસી કો નહીં લે ચલના હૈ। અમી તો હમ તીનો હી ચલેંગે। કલ શહર ચલને કે લિએ મૈં અપની ગાડી તૈયાર કરવાતા હું। હમ સવેરે દસ બજે ચલેંગે। મૈં 9 બજે ગાડી આપકે ઘર ભિજવા દુંગા। આપ તૈયાર રહના। (અગલે દિન તીનો દુગ્ધ સહકારી સમિતિ અધ્યક્ષ કે કાર્યાલય પહુંચતે હૈને।

સરપંચ : અધ્યક્ષ જી હમ અંદર આ જાએં?

અધ્યક્ષ : આઇએ, આઇએ ઔર પૂરણ જી, સરપંચ જી, આઇએ, ઓ હો! મુખ્યિયા જી ભી સાથ આએ હૈને। લગતા હૈ કે કોઈ નર્ઝ યોજના બનાઈ હૈ।

તીનો : નમસ્કાર સાહેબ।

અધ્યક્ષ : નમસ્કાર બૈઠિએ। કહિએ કૈસે આના હુઆ?

સરપંચ : હમને આપકી પ્રેરણા ઔર સહયોગ સે અપને ગાંધ મેં દુગ્ધ સમિતિ કા ભવન બનવા કર તૈયાર કરવા દિયા હૈ। સબ કી ઝચ્છા હૈને કે ઉસ ભવન કા ઉદ્ઘાટન આપ સે કરવાએં।

અધ્યક્ષ : અરે સરપંચજી આપણે બધા તો એક જ મંડળના સભ્યો હીએ. સાંકું થશે કે આપણે કોઈ બીજા પાસેથી ઉદ્ઘાટન કરાવડાવી લઈએ.

મુખી : આપનું કહેવું તો યોગ્ય છે. પણ અમે નક્કી કરી લીધું છે કે આ મકાનનું ઉદ્ઘાટન અમારે આપની પાસેથી જ કરાવવું છે.

પૂરણભાઈ : શ્રીમાન આપની પ્રણા અને સહયોગથી જ આ મંડળી બની છે. આ મકાન પણ તમારા સહયોગથી બન્યું છે. તેથી આનું ઉદ્ઘાટન પણ અમે આપની પાસેથી જ કરાવવા ઈચ્છીએ હીએ. આપ જો આપની સ્વીકૃતિ આપશો અને આપના વ્યસ્ત સમયમાંથી થોડો સમય કાઢશો તો કૃપા થશે.

અધ્યક્ષ : પૂરણભાઈ, મેં તમારા ખૂબ વખાણ સાંભળ્યા છે. તમે જે તત્પરતાથી તમારી શાળા ચલાવી રહ્યા છો, તે જ તત્પરતાથી તમારે આ મંડળીને પણ ચલાવવાની છે. મારી પાસેથી જે સહયોગ કરાવવો હોય તે તમે મુખીને કહેવડાવી દ્વારા.

પૂરણભાઈ : સાહેબ ગામની સેવા કરવી તે માંનું કર્તવ્ય છે. મારાથી જેટલી થઈ શકશે તેટલી સેવા કરતો રહીશ.

સરપંચ : એક વાત બીજી પણ છે. ગૌચરમાં વૃક્ષારોપણ પણ કરાવવું છે. ત્યાં અમે લગભગ એક સો વૃક્ષો લગાવડાવવા ઈચ્છીએ હીએ. અમે બધાં

અધ્યક્ષ : અજી સરપંચ જી હમ સબ તો એક હી સમિતિ કે સદસ્ય હોયા હોય કિ હમ કિસી ઔર સે ઉદ્ઘાટન કરવા લેં.

મુખ્યા : આપકા કહના તો ઠીક હૈ લેકિન હમને તયકર લિયા હૈ કિ, ઇસ ભવન કા ઉદ્ઘાટન હમેં આપસે હી કરાના હૈ.

પૂરણ જી : શ્રીમાન જી આપ કી પ્રેરણા ઔર સહયોગ સે હી યહ સમિતિ બની હૈ। યહ ભવન ભી આપકે હી સહયોગ સે બના હૈ। ઇસલિએ ઇસકા ઉદ્ઘાટન ભી હમ આપ સે હી કરવાના ચાહતે હોયા હૈનું। આપ યદિ અપની સ્વીકૃતિ પ્રદાન કરેંગે ઔર અપને વ્યસ્ત સમય મેં સે થોડા સમય નિકાલેંગે તો કૃપા હોયા હોયા હૈનું।

અધ્યક્ષ : પૂરણ જી, મૈંને આપકી બહુત તારીફ સુની હૈ। આપ જિસ તત્પરતા સે અપની પાઠશાળા ચલા રહે હોયા હૈ, ઉસી તત્પરતા સે આપકો ઇસ સમિતિ કો ભી ચલાના હૈ। મુજબ સે જો સહયોગ કરવાના હો વહ આપ મુખ્યા જી સે કહલવા દેના।

પૂરણ જી : સર, ગાંવ કી સેવા કરના વહ મેરા કર્તવ્ય હૈ। મુજબ સે જિતની હો સકેગી ઉતની સેવા કરતા રહ્યું હોયા હૈ।

સરપંચ : એક બાત ઔર ભી હૈ, ચરાગાહ મેં વૃક્ષરોપણ ભી કરવાના હૈ। વહોં હમેં લગભગ એક સૌ વૃક્ષ લગવાના હોયા હૈનું। હમ સભી અતિથિઓ સે એક-એક વૃક્ષ લગવાના-ચાહતે હોયા હૈનું।

અતિથિઓ પાસેથી એક-એક
વૃક્ષ લગાવડાવવા ઈચ્છાએ
છીએ.

મુખી : અમે તમને બધી ગૌચરની ભૂમિ દેખાડવા ઈચ્છાએ છીએ.
તે જ દિવસે આપની ઉપસ્થિતિમાં તલાટી પાસેથી ગૌચરની ભૂમિને મપાવીને તેનું સીમાંકન પણ કરાવી શકીએ.

અધ્યક્ષ : સારું. સરપંચજ હું આવી જઈશ. તમે તારીખ અને સમય જણાવી દો.

પૂરણભાઈ : સાહેબ. જો આપ આવતા સોમવારનો સમય નીકળશો તો સારું રહેશે. તે દિવસે બાર તારીખ છે. સવારે અગિયાર વાગ્યાનું મુહૂર્ત કઢાવી દીધું છે. બધા અતિથિઓ માટે ભોજન પણ બનાવડાવીશું. જો તમે કહેશો તો અતિથિઓ માટે મુખીની ગાડી મોકલાવી દઈશું.

સરપંચ : તે જ ગૌચર ભૂમિમાં એક કૂવો ખોદાવવાની પણ યોજના છે. જો કયાંકથી આર્થિક સહયોગ મળશે તો કેટલાક ગામવાળા પાસેથી શ્રમદાન કરાવી લઈશું.

અધ્યક્ષ : સારું. તમે લોકો તૈયારીઓ કરો. હું સમયસર બધાની સાથે પહોંચી જઈશ.
ત્યાં જ આખી યોજના બનાવડાવી લઈશું.

બધા : આભાર. નમસ્કાર.

અધ્યક્ષ : નમસ્કાર.

મુખ્યા : હમ આપકો પૂરી ચરાહગાહ કી ભૂમી દિખાના ચાહતે હું. ઉસી દિન આપકી ઉપસ્થિતિ મેં પટવારી સે ચરાગાહ કી ભૂમી કો નપવા કર ઉસકા સીમાંકન ભી કરાસકેં।

અધ્યક્ષ : ઠીક હૈ। સરપંચ જી મૈં આ જાઊંગા।
આપ તારીખ ઔર સમય બતા દેં।

પૂરણજી : સર। યદી આપ અગલે સોમવાર કા સમય નિકાલેંગે તો ઠીક રહેગા। ઉસ દિન 12 તારીખ હૈ। પ્રાતઃકાલ 11 બજે કા મુહૂર્ત નિકલવા લિયા હૈ। સારે અતિથિયોં કે લિએ ભોજન ભી બનવાએંગે। યદિ આપ કહેંગે તો અતિથિયોં કે લિએ મુખ્યા જી કી ગાડી ભિજવા દેંગે।

સરપંચ : ઉસી ચરાહગાહ ભૂમિ મેં એક કુआ ભી ખુદવાને કી યોજના હૈ। યદિ કહીં સે આર્થિક સહયોગ મિલા તો ગાঁવવાલોં સે ભી શ્રમ દાન કરાલેંગે।

અધ્યક્ષ : ઠીક હૈ। આપ લોગ તૈયારિયોં કીજિએ। મૈં સમય પર સબ કે સાથ પહુંચ જાઊંગા। વહોંસ સારી યોજના બનવા લેંગે।

સમી : ધન્યવાદ, નમસ્કાર।

અધ્યક્ષ : નમસ્કાર।

શબ્દાચ

ગુજરાતી શબ્દ	હિંદી અર્થ
સરપંચ	સરપંચ
મુખી	મુખિયા
દૂધ	દૂધ/દુઃધ
સહકારી/સહયોગ	સહકારી/સબ કે સહયોગ સે
મંડળી	સમિતિ
ઉદ્ઘાટન	ઉદ્ઘાટન
કરાવવું/કરાવડાવવું	કરાના/કરવાના
અધ્યક્ષ	અધ્યક્ષ
પર્યાવરણ	પર્યાવરણ
ગૌચરભૂમિ	ચરાહગાહ/ગોચર ભૂમિ
વૃક્ષારોપણ	વૃક્ષારોપણ
વવડાવવું	(વૃક્ષ) લગવાના
છાંયડો	છાયા
ચરાવવું	ચરાના
શહેર	શહર/નગર
નક્કી	તય
સમજદાર	સમજદાર
લેખિત	લિખિત
બનાવડાવવું	બનવાના
મોકલાવવું	મિજવાના
યોજના	યોજના
મકાન	ભવન/મકાન
કોઈ	કોઈ/કિસી
પ્રેરણા	પ્રેરણા
પ્રદાન	પ્રદાન/દેના
વ્યસ્ત	વ્યસ્ત
કાઢવું	નિકાલના
વખાણ	તારીફ/પ્રશંસા
સાંભળવું	સુનના
તત્પરતા	તત્પરતા
ચલાવવું	ચલાના
કહેવડાવવું	કહલવાના
સેવા	સેવા
કર્તવ્ય	કર્તવ્ય

લગાવડાવવું	લગવાના (વૃક્ષ)/રોંપના
અતિથિ	અતિથિ
ઉપસ્થિતિ	ઉપસ્થિતિ
તલાટી	પટવારી
માપવું	નાપના
સીમાંકન	સીમા તય કરના
જણાવવું	બતાના
ખોદાવવું/ખોદાવડાવવું	ખુદવાના
ગામવાળા	ગાঁવવાળે
શ્રમદાન	શ્રમદાન
સમયસર	સમય પર

અભ્યાસ

I નીચે આપેલાં વાક્યોનો અભ્યાસ કરો.

- 1) મકાનનું ઉદ્ઘાટન પણ કરાવવું પડશે.
- 2) કેટલાંક વૃક્ષો વવડાવી લઈશું.
- 3) પશુઓને ચરાવવામાં સરળતા રહેશે.
- 4) હું મારી ગાડી તૈયાર કરાવું છું.
- 5) હું મારી ગાડી તમારા ઘરે મોકલાવીશ.
- 6) મકાનનું ઉદ્ઘાટન તમારી પાસેથી જ કરાવવું છે.
- 7) સો વૃક્ષો લગાવડાવવા ઈચ્છીએ છીએ.

II ઉદાહરણ પ્રમાણે કોણમાં આપેલા કિયારુપોનાં યોગ્ય ઝપોનો ઉપયોગ કરી વાક્યો પૂરાં કરો.

ઉદાહરણ : 1) પશુઓને _____ માં સરળતા રહેશે. (ચરવું)
પશુઓને ચરાવવામાં સરળતા રહેશે.

2) હું પૂરણભાઈને _____ લઈશ. (બોલાવવું)
હું પૂરણભાઈને બોલાવડાવી લઈશ.

- 1) હું મારી ગાડી તૈયાર _____ છું. (કરવું)
- 2) ગૌચરભૂમિમાં કૂવો _____ પડશે. (ખોદવું)
- 3) કપડાં _____ ને તૈયાર કરાવડાવી દીધાં છે. (સીવવું)
- 4) અમે સો વૃક્ષો _____ ઈચ્છીએ છીએ. (લગાવવું)
- 5) અતિથિઓ માટે ભોજન પણ _____. (બનાવવું)
- 6) ગામવાળા પાસેથી શ્રમદાન _____ લઈશું. (કરવું)
- 7) મુખીની ગાડી તમારા ઘરે _____ દઈશ. (મોકલવું)
- 8) બીજા કોને કોને _____ છે? (બોલાવવું)

- 9) અમારે તમને અમારું ઘર _____ છે. (દેખવું)
 10) ઉદ્ધારનનો લેખિત કાર્યક્રમ પણ _____ પડશે. (બનાવવું)
 11) તેમણે ઘરણાં વૃક્ષો _____ છે. (વાવવું)

III ઉદાહરણ પ્રમાણે નીચે આપેલાં વાક્યોનું પરિવર્તન કરો.

ઉદાહરણ : દૂધ સહકારી મંડળીનું મકાન બનાવ્યું છે.
 દૂધ સહકારી મંડળીનું મકાન બનાવડાવ્યું છે.

- 1) અમે દૂધ સહકારી મંડળીની રચના કરી છે.
 2) બાપુજીએ દીકરીને આપ્યો છે.
 3) આપણે વૃક્ષો લગાવવા જોઈએ.
 4) મંત્રીજી ઉદ્ધારન કરશે.
 5) તેમણે મારી પાસેથી સહયોગ કરાવ્યો હતો.
 6) મારે ઘરણાં કપડાં સિંચવવાનાં છે.
 7) મારે કેટલાંક વૃક્ષો વાવવાનાં છે.

IV ડાખીબાજુ આપેલાં વાક્યાંશોને જમણીબાજુ આપેલાં વાક્યાંશો સાથે યોગ્ય રીતે જોડીને વાક્યો બનાવો.

- | | |
|------------------------------|--------------------------|
| 1) ગૌચર ભૂમિમાં વૃક્ષારોપણ | - ચરાવવામાં સરળતા રહેશે. |
| 2) પશુઓને ગૌચર ભૂમિમાં | - પણ બનાવડાવવો પડશે. |
| 3) ઉદ્ધારનનો લેખિત કાર્યક્રમ | - લગાવડાવ્યા હતાં. |
| 4) ગામમાં થોડા કૂવા | - પણ કરાવવું પડશે. |
| 5) દરેક જણ પાસે એક એક વૃક્ષ | - ખોદાવવા છે. |

V કેંશમાં આપેલા હિન્દી શબ્દોના સમાનાથી ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરી વાક્યો પૂરાં કરો.

- 1) અંબાલાલભાઈ પાસે વૃક્ષારોપણ _____. (કરવાએંંગે)
 2) દૂધ સહકારી મંડળીનું મકાન ____ છે. (બનવાયા)
 3) સાચું _____ માટે પૈસા વાપરવા પડે. (ખિલાને)
 4) મહેશભાઈએ દીકરીના લગનમાં સ્વાદિષ્ટ ભોજન _____ હતું. (બનવાયા)
 5) તેમણે પોસ્ટથી ચોપડી _____ છે. (ભીજવાઈશ)

VI નીચે આપેલાં વાક્યોનાં નિર્ણયવાચક ઝપ બનાવો.

- 1) દૂધ વેચવા દૂરના ગામમાં જવું પડશે.
 2) મંડળીના સભ્યોની ધારી કરાવડાવી છે.
 3) હું મારી ગાડી મોકલાવીશ.
 4) ગામમાં કૂવા ખોદાવડવવા છે.

- 5) ગામવાળા પાસેથી શ્રમદાન કરાવીશું.
 6) અંબાલાલભાઈને બોલાવડાવવા છે.
- VII નીચે આપેલા ગુજરાતી શબ્દોના હિન્દી શબ્દો આપો.
 મુખી, ગૌચર, ભૂમિ, છાંયડો, નક્કી, મકાન, કોઈ, વખાણ, સમયસર, તલાટી.
- VIII નીચે આપેલા હિન્દી શબ્દોના ગુજરાતી શબ્દો આપો.
 કહલવાના, કરાના, કરવાના, ખુદવાના, ચલવાના, લગવાના, દિખાના, બનવાના, બુલવાના, મિજવાના।
- IX કૌશમાં આપેલાં પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ કરી નીચે આપેલાં વાક્યો
 પ્રશ્નવાચક વાક્યો બનાવો.
- 1) સાહેબ બધાંની રાહ જોતા હતા. (કોણી)
 - 2) અંબાલાલભાઈના ઘરે ગાડી મોકલાવવાની છે. (શું)
 - 3) નવા મકાનનું ઉદ્ઘાટન કરાવવાનું છે. (શાનું)
 - 4) આવતીકાલે વૃક્ષો લગાવડાવવાનાં છે. (ક્યારો)
 - 5) ગૌચરમાં કૂવો ખોદવવાનો છે. (ક્યાં)
 - 6) મેં તેમને દસ વાગે બોલાવડાવ્યા છે. (કેટલા વાગે)
 - 7) કાર્યક્રમ તો પૂરણભાઈ જ સારી રીતે બનાવડાવી શકશે. (કોણ)

વાંચો અને સમજો

સહકાર

એવું કહેવાય છે કે ‘જાજ હાથ રળિયામણા’. આ કહેવતને આપણે આપણા જીવનનો આધાર બનાવવો પડશે. સહકાર આપણી સામાજિક રચનાનો મૂળ આધાર છે. આપણે ફરી એકવાર આપણી સહકારીતાની પરંપરાને સમજવી પડશે. અને તે જ આધાર પર આપણા સમાજને ઢાળવો પડશે. સ્વતંત્રતા પણી આપણે ફરી એકવાર સહકારીતાના મહત્વને સમજ્યા છીએ. હવે આપણે લાગુ કરવી પડશે. જેટલો ગામડાઓનો વિકાસ સહકારીતાથી સંભવ છે તેટલો સારો બીજા કોઈ પ્રકારે નહીં. જો આપણે ગામડાઓનો સમગ્રઝપે વિકાસ કરવો હોય તો સહકારના માધ્યમ દ્વારા જ તેને સાકાર કરવો પડશે. આપણે એક બીજાના સુખદુઃખમાં ભાગીદારી કરવી પડશે. એક બીજાની ભાવનાઓને સમજવી અને સમજાવવી પડશે.

ગામડાઓમાં જો આપણે સહકારીતાને અપનાવીએ તો આપણે સહકારી મંડળીઓ બનાવીને શાસન પાસેથી ઘણો સહયોગ કરાવી શકીએ છીએ. પણ આ માટે આપણે આપણી યોજના બનાવવી પડશે અને તે યોજનાની સાર્થકતાથી શાસનને પરિચિત કરાવવું પડશે. ઉદાહરણ માટે જો આપણે ગામડાઓમાં દૂધ

સહકારી મંડળીની રચના કરવી હોય તો પહેલાં આપણે આપણા સહયોગીઓની એક યાદી બનાવવી પડશે. કેટલાક લોકોને તકનીકી જાણકારી મેળવવા પ્રશિક્ષણ માટે પણ મોકલવા પડશે. આર્થિક સહાયતા માટે બેંક પાસેથી ઝણ(લોન) લેવા માટે પ્રયત્ન કરવો અને કરાવવો પડશે. જો આપણે સફળતા પૂર્વક ગામમાં દૂધ સહકારી મંડળીની રચના કરાવી લઈએ તો ગામના દૂધ વેપારીઓ અને ઝડૂતોને આપણે સારો લાભ અપાવી શકીશું.

આવી જ ઘણી સહકારી સમિતિઓનું નિર્માણ કરાવીને આપણે ગામમાં લોકોને સહકારીતા માટે જાગૃત કરી શકીએ છીએ. તેથી જ કહેવાયું છે કે, ‘વિના સહકાર નહીં ઉદ્ઘાર’. એક બીજાના સહકારથી જ આપણે આર્થિક વિકાસના સપનાને સિક્ક કરી શકીએ છીએ. તેથી આપણે ગામડાઓને આર્થિક, સામાજિક રીતે સક્ષમ બનાવી શકીએ છીએ. પણ આપણા આ ઉદેશ્યને પ્રાપ્ત કરવા માટે આપણે બધાને એક થતું પડશે.

શબ્દાર્થ

ગુજરાતી શબ્દ	હિંદી અર્થ
સહકાર	સહકાર
સમગ્રસ્પ	સમુચ્ચિત/સમગ્રતયા/સમગ્રરૂપ સે
ભાગીદારી	ભાગીદારી/હિસ્સેદારી
ભાવના	ભાવના
અપનાવવું	અપનાના
સાર્થકતા	સાર્થકતા
પરિચિત	પરિચિત
તકનીકી	તકનીકી
પ્રશિક્ષણ	પ્રશિક્ષણ
ઝણ/લોન	ઝણ/કર્જ
સફળતા	સફળતા
પૂર્વક	પૂર્વક
જાગૃત	જાગરૂક
સપના	સપને
સિક્ક	સિદ્ધ/સાકાર
સક્ષમ	સક્ષમ

અત્યાસ

- I પરિચ્છેદના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.**
- 1) આપણી સામાજિક રચનાનો મૂળ આધાર શું છે?
 - 2) ગામડાઓનો વિકાસ કેવી રીતે સારો થઈ શકે છે?
 - 3) આપણે શેમાં ભાગીદારી કરવી પડશે? શું સમજવું પડશે?
 - 4) ગામડાઓમાં સહકારી સમિતિઓ બનાવીને કોની પાસેથી સહયોગ કરાવી શકાય?
 - 5) દૂધ સહકારી મંડળીની રચનાથી કોને લાભ અપાવી શકીશું?
 - 6) આપણે દૂધ સહકારી સમિતિની રચના કરવી હોય તો શું શું કરવું પડશે?
 - 7) આર્થિક, સામાજિક રીતે સક્ષમ બનવા શું કરવું પડશે?
 - 8) આ પરિચ્છેદમાં આપેલી બે કહેવતોનો અર્થ સમજાવો.
- II નીચે આપેલા શબ્દોનો વાક્યોમાં ઉપયોગ કરો.**
- પરંપરા, સહકાર, સમાજ, મહાત્વ, વિકાસ, માધ્યમ, સુખદુઃખ, મંડળી, ભાગીદારી, સમગ્રસ્પ, સમિતિ, તકનીકી, પ્રયત્ન, આર્થિક, સામાજિક, ઉદેશ્ય.
- III નીચે આપેલા ગુજરાતી શબ્દોના હિન્દી શબ્દો આપો.**
- ગામડું, સફળતા, સહકાર, ભાગીદારી, ઝાણ, જાગૃત, પ્રશિક્ષણ.
- IV હિન્દીમાં અનુવાદ કરી પોય શીર્ષક આપો.**
- અહિંસાનો સંદેશ આપણને દરેક ધર્મના ધર્મગુરુઓ પાસેથી મળે છે. વેદોથી લઈને વિનોભા સુધી બધાંએ પોતપોતાની રીતે અહિંસાનો સંદેશ આપ્યો છે. પરંતુ સૌથી પહેલાં અહિંસાનો સંદેશ આપણને મહાત્મા બુદ્ધ અને મહાવીર સ્વામી પાસેથી મળે છે. બૌદ્ધધર્મ અને જૈન દર્શનનો મૂળ આધાર જ અહિંસા છે. ગાંધીજીને પોતાના જીવનમાં અહિંસાની સાથે સત્યનો સમાવેશ કર્યો અને સત્ય-અહિંસાનો સંદેશ ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં આ સંદેશ આપ્યો છે. આજે વિશ્વ આતંક અને ભયના વાતાવરણમાં જીવી રહ્યું છે. દરેક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર પર પોતાનો પ્રભાવ સ્થાપિત કરવા ઈચ્છે છે. એવામાં આપણને ગાંધીજીએ શાંતિ અને સદ્ગ્રાવનો માર્ગ બતાવ્યો છે. જો આપણા વિચારો અને આચરણમાં સત્ય અને અહિંસાનો સમાવેશ થઈ જાય તો આપણા પ્રત્યેક કાર્યમાં વિશ્વકલ્યાણની ભાવના જાગૃત થઈ શકે.
- આજે સમગ્ર વિશ્વમાં ગાંધીજિના સત્ય અને અહિંસાનો માર્ગ સ્વીકારે છે. જો પહેલાં વિશ્વને આ દર્શન અપનાવી લીધું હોત તો ગાંધીજીની વિશ્વકલ્યાણની ભાવના સાકાર થઈ ગઈ હોત. વૈશ્વિકરણની દિશામાં કરેલા આપણા બધા પ્રયત્ન સફળ થઈ શકે. જ્યારે આપણે અહિંસાનો વાસ્તવિક

અર્થ સમજુ અને સ્વીકાર કરીશું. કેવળ સ્વીકાર જ નહીં પણ ગાંધીવિચાર અંગીકૃત કરવો જોઈએ. તથા પોતાના આચરણનો અંગ બનાવવો જોઈએ.

V ગુજરાતીમાં અનુવાદ કરી ઘોય શીર્ષક આપો.

ગાંધું હમારી સંસ્કૃતિ કે પોષક હૈનું. ઇસલિએ હમેં ગાંધું કા વિકાસ કરને મેં સદા પ્રયત્ન કરના ચાહિએ। ગાંધું કો સર્જક સે જોડના ઔર ઉસકે વિકાસ કે લિએ શાસન કો ભી યોજનાએં બનાના ચાહિએ।

હમારી આર્થિક ઉત્ત્રતિ ગાંધું પર નિર્ભર હૈ। ઇસલિએ ગાંધું કા વિકાસ કરના ઔર શાસન સે કહ કર ઉસ મેં સમસ્ત આવશ્યકતાએં જુટાના હમારા કર્તવ્ય હૈ।

ગાંધું કો કીચડ સે મુક્ત કરવાના, ગલિયોં કો પક્કા બનવાના, પાની કે નિકામ કે લિએ નાલિયાં બનવાના બહુત આવશ્યક હૈ।

શિક્ષા કી સુવિધાએં ઉપલબ્ધ કરવાના ભી ઉતના હી આવશ્યક હૈ જિતના ગાંધું કો સ્વચ્છ બનાના। શિક્ષા કે પ્રસાર કે લિએ બચ્ચોં કો વ ઉનકે માતા-પિતા કો પ્રેરિત કર બચ્ચોં કો પાઠશાલા ભિજવાને કી વ્યવસ્થા કરના તથા શાસન દ્વારા સ્કૂલ ખુલવાના ભી આવશ્યક હૈ। યદિ ગાંધું કે બચ્ચે પઢે લિખે હોંગે તો વે અપને જીવન મેં તો ઉત્ત્રતિ કરેંગે હી સાથ-સાથ ગાંધું કે વિકાસ મેં ભી યોગદાન કરેંગે।

શિક્ષકા કે હી સમાન સ્વાસ્થ કી સુવિધાએં ભી ગ્રામીણ ક્ષેત્ર મેં આવશ્યક હૈ। ગાંધું મેં એક પ્રાથમિક ચિકિત્સા ખુલવાના તો બહુત હી આવશ્યક હૈ। યહ કાર્ય પંચાયતોં કે પ્રતિનિધિયોં દ્વારા શાસન કે સહયોગ સે કરવાના ચાહિએ।

ગાંધું કો સુંદર બનાને કે લિએ ભી હમેં હર તરહ કા પ્રયાસ કરના ચાહિએ। ગાંધું કે ચારોં ઓરે પેડે લગવાના। પેય જલ કી તથા પ્રકાશ કી ઠીક-ઠીક વ્યવસ્થા જુટાના ભી આવશ્યક હૈ। જૈસે-જૈસે હમારે ગાંધું વિકસિત હોતે જાએંગે વૈસે-વૈસે હમારા દેશ સમૃદ્ધ હોતા જાએગા। ઇસલિએ ગાંધું કી જનતા કા, શાસન કા તથા અન્ય પ્રતિનિધોયોં કો ગાંધું કા વિકાસ કરને કે લિએ પૂરા-પૂરા પ્રયત્ન કરના ચાહિએ।

શાખાથ

હિંદી શાખા

સર્જક

ઉત્ત્રતિ

નિર્ભર

સમસ્ત

કીચડ

ગલિયાં

પક્કા

વિકાસ

નાલિયાં

ગુજરાતી અર્થ

રસ્તો/માર્ગ/સરક/રોડ

ઉજ્જ્વલિ

નિર્ભર

સમસ્ત/સમગ્ર

કીચડ/કાદવ

ગલિયો/શેરી

પાક્કો

નિકાલ

નીક

પ્રસાર	પ્રસાર
ખુલવાના	ખોલાવવું
ચિકિત્સા	ચિકિત્સા
પંચાયત	પંચાયત
પ્રતિનિધિ	પ્રતિનિધિ
હર તરહ	બધી રીતે
પેય જલ	પીવાનું પાણી
જનતા	જનતા
વિકસિત	વિકસિત

VI તમારા ગામમાં સહકારી ધોરણે ચાલતી કોઈ પ્રવૃત્તિ ઉપર ગુજરાતીમાં પરિચ્છેદ લખો.

ટિપ્પણિયાં

I ઇસ પાઠ મें નિમ્ન પ્રકાર કે વાક્યોं કા પરિચય દિયા ગયા હૈ।

- 1) મકાનનું ઉદ્ઘાટન પણ કરાવવું ભવન કા ઉદ્ઘાટન ભી કરાના પડેગા।
પડશે.
- 2) ગૌચર ભૂમિમાં વૃક્ષારોપણ કરાવડાવવું પડશે. ચરાહગાહ મેં વૃક્ષારોપણ કરવાના પડેગા।
- 3) મકાન બનાવડાવીને તૈયાર કરવી ભવન બનવા કર તૈયાર કરવા દિયા હૈ।
દીધું છે.
- 4) એક કૂવો ખોદાવવાની યોજના છે. એક કુआ ખુદવાને કી યોજના હૈ।
ઉપર્યુક્ત વાક્યોં સેં રેખાંકિત કિયા-રૂપ હિંદી કે 'કરાના', 'કરવાના', 'બનવાના',
'ખુદવાના' જૈસે પ્રેરણાર્થક ક્રિયાઓં કે પ્રયોગ હૈનું। ('કરવું' (કરવું), 'કરાવવું' (કરાના),
'કરાવડાવવું' (કરાના), 'કરાવડાવવું' (કરવાના))
 - 1) હું કામ કરું છું. મૈં કામ કરતા હું।
 - 2) હું તેની પાસે કામ કરાવું મૈં ઉસ સે કામ કરાતા હું/કરવાતા હું।
છું./કરાવડાવવું છું.
 - 3) હું નોકરને કહીને તેની પાસે મૈં નૌકર સે કહ કર ઉસ સે કામ કરાતા
કામ કરાવું છું./કરાવડાવવું છું. હું /કરવાતા હું।

ઉપર કે તીનોં વાક્યોં મેં પહલે વાક્ય મેં ક્રિયા કરને વાલા એક હી હૈ ઔર વહ સ્વયં
ક્રિયા કરતા હૈ। દૂસરે વાક્ય મેં ક્રિયા કરને વાલા એક હૈ (અર્થાત् 'તે' (તે) (વહ) ઔર કરાને
વાલા દૂસરા (અર્થાત् 'હું' (હું))। તીસરે મેં કરને વાલા એક હૈ (અર્થાત् 'તે' (તે) 'વહ') હૈ ઔર
કરાને વાલે દો હૈનું (અર્થાત્ 'હું' (હું) (મૈં) તથા 'નોકર' (નોકર)। દૂસરે ઔર તીસરે વાક્યોં મેં દો

પ્રકાર કી પ્રેરણાર્થક ક્રિયાએ પ્રયુક્ત કી ગઈ હૈનું। ધ્યાન દેં કી પ્રેરણાર્થક ક્રિયાવાળે વાક્યો મેં અપાદાન કારક દિખાને વાળે પરસર્ગ 'પાસેથી' (પાસેથી) 'સે' કા પ્રયોગ હોતા હૈ। યહ સ્પષ્ટ રૂપ મેં પરસર્ગ હોતા હૈ યા વાક્ય મેં અંતરલીન હોતા હૈ જો અર્થ સે સ્પષ્ટ હોતા હૈ।

॥ ગુજરાતી મેં પ્રેરણાર્થક ક્રિયા-રૂપ નિમ્ન પ્રકાર સે બનતે હૈનું।

1. વ્યંજનાંત ક્રિયાએँ।

- | | | | |
|----|-----------|-----------|--------------|
| 1) | લખ-વું | લખાવવું | લખાવડાવવું |
| 2) | કર-વું | કરાવવું | કરાવડાવવું |
| 3) | ચડ-વું | ચડાવવું | ચડાવડાવવું |
| 4) | દેખ-વું | દેખાવવું | દેખાવડાવવું |
| 5) | સાંભળ-વું | સંભળાવવું | સંભળાવડાવવું |
-
- 1) મેં તેની પાસેથી પત્ર લખાવ્યો.
 - 2) મકાનનું ઉદ્ઘાટન કરાવડાવ્યું.
 - 3) તે ખૂબ ઊંચે ધજા ચડાવડાવવાના છે.
 - 4) તે છોકરીને છોકરો દેખાડવો પડશે.
 - 5) તમારે મને ગીત સંભળાવવું પડશે.

ઉપર્યુક્ત ઉદાહરણોં સે સ્પષ્ટ હૈ કી મૂલ ક્રિયા સે પ્રેરણાર્થક ક્રિયા બનાને કે લિએ 'આવ' (આવ) યા 'આડ' (આડ) પ્રત્યય જોડે ગએ હૈનું। યહ ભી સમઝાએ કી મૂલ ક્રિયા કે મધ્ય મેં 'આ' (આ) યા 'અં' (અં) સ્વર હૈનું તો વે પ્રેરણાર્થક રૂપ મેં 'અ' (અ) યા 'અં' (અં) હો જાતે હૈનું।

2. સ્વરાંત ક્રિયાએँ

- | | | | |
|----|----------|--------------------|--------------|
| 1) | પી-વું | પીવાડવું/પીવડાવવું | પીવડાવડાવવું |
| 2) | ખા-વું | ખવાડવું/ખવડાવવું | ખવડાવડાવવું |
| 3) | ગા-વું | ગવાડવું/ગવડાવવું | ગવડાવડાવવું |
| 4) | દે-વું | દેવાડવું/દેવડાવવું | દેવડાવડાવવું |
| 5) | લે-વું | લેવાડવું/લેવડાવવું | લેવડાવડાવવું |
| 6) | નાહિ-વું | નવાડવું/નવડાવવું | નવડાવડાવવું |
-
- 1) ગીતાએ ગાયને પાણી પીવડાવડાવ્યું.
 - 2) માએ બાળકને ખીચડી ખવડાવી.
 - 3) રમાએ મને કહીને પ્રેરણા પાસેથી ગીત ગવડાવડાવ્યું.
 - 4) પૂજાએ સોનાની ચેન લેવડાવડવી.
 - 5) બાળકને રોજ નવડાવવું જોઈએ.

ધ્યાન દીજિએ કિ સ્વરાંત ક્રિયાઓં કે સાથ 'આવ' (આવ), 'આડ' (આડ) પ્રેરણાર્થક પ્રત્યય જોડને સે પહલે 'વ' (વ) જોડા જાતા હૈ। યદિ મૂલ ક્રિયા કા અંતિમ સ્વર 'આ' (આ) હૈ તો યહ 'અ' (આ) મેં બદલ જાતા હૈનું ઔર ઉસકે બાદ 'વ' (વ) તથા 'આવ' (આવ) અથવા 'આડ' (આડ) જોડે જાતે હૈનું।

III અપવાદ

- | | | | |
|----|---------|------------------|-------------|
| 1) | ટેક-વું | ટેકવવું/ટેકાવવું | ટેકાવડાવવું |
| 2) | ચેત-વું | ચેતવવું | ચેતાવડાવવું |
| 3) | ખીલ-વું | ખીલવવું | ખીલાવડાવવું |
| 4) | ખર-વું | ખરવવું | ખરાવડાવવું |
| 5) | ફર-વું | ફરવવું/ફરાવવું | ફરાવડાવવું |
| 6) | મળ-વું | મેળવવું | મેળાવડાવવું |
| 7) | છોડ-વું | છોડવવું | છોડાવડાવવું |
- 1) દાદાએ નીચે પડેલી ડાંગ ટેકાવડાવી.
 2) મારે તેને ચેતવવી જોઈતી હતી.
 3) ભગવાન સૂર્યના કિરણોથી સૂર્યમુખીના ફૂલને ખીલવડાવે છે.
 4) ઝઘડતા લોકોને છોડાવવા જોઈએ.
 5) બોરડી પરથી બોર ખેરવડાવીને ખાવા સારા લાગે છે.
- ઉપર બતાએ ગએ જૈસે કુછ ગુજરાતી ક્રિયા-રૂપોં મેં જબ પ્રેરણાર્થક પ્રત્યય 'વ' (વ) જોડા જાતા હૈ તબ મૂલ ક્રિયા કા 'અ' (આ) 'એ' (એ) મેં પરિવર્તિત હો જાતા હૈ।

ધ્યાન દીજિએ કી સબ ક્રિયાઓં કા પ્રેરણાર્થક રૂપ નહીં હોતે હૈનું। જૈસે કી, આ, જા।